



SEC/0106/2021

By E-Filing

1st June, 2021

<p>National Stock Exchange of India Ltd. "Exchange Plaza", C-1, Block G, Bandra- Kurla Complex, Bandra (E), <u>Mumbai – 400 051.</u></p> <p>Scrip Symbol : APARINDS</p> <p><u>Kind Attn.: The Manager, Listing Dept.</u></p>	<p>BSE Ltd. Corporate Relationship Department, 27th Floor, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, <u>Mumbai - 400 001.</u></p> <p>Scrip Code : 532259</p> <p><u>Kind Attn.: Corporate Relationship Dept.</u></p>
---	--

Subject: Publication of Extract of Audited Financial Results for the 4th Quarter and Financial Year ended March 31, 2021 in Newspapers.

Ref : Regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time.

Dear Sir(s) / Madam,

Refer to our Letter No. SEC/3105/2021 dated 31st May, 2021 vide which we have submitted the Standalone and Consolidated Audited Financial Results of the Company for the Fourth Quarter and Financial Year ended 31st March, 2021 (2020-21), we are now submitting herewith copies of the Extract of Audited Financial Results of the Company for the 4th Quarter and Financial Year ended March 31, 2021, on Consolidated basis, published in Business Standard, English language newspaper (having Nationwide Circulation) and Vadodara Samachar (Regional language newspaper) at Vadodara, Gujarat on 1st June, 2021.

The above information is also available on the Company's website at www.apar.com.

Kindly take the above information on your record.

Thanking you,

Yours Faithfully,
For Apar Industries Limited


Harishkumar Malsatter
(Asst. Manager- Secretarial & Legal)

Encl.: As above

APAR Industries Limited

Regd Office: 301/306, Panorama Complex, RC Dutt Road, Alkapuri, Vadodara - 390007, India
+91 265 6178 700/6178 709 apar.baroda@apar.com www.apar.com

Corporate Office: APAR House, Corporate Park, V N Purav Marg, Chembur, Mumbai 400 071, India
+91 22 2526 3400/6780 0400 corporate@apar.com www.apar.com CIN: L91110GJ1989PLC012802

Bank of Baroda
Opad Branch, Opad Surat Main Road, C/o Patel Timber Mart, Beside Gujarat Petroleum, Opad, Dist - Surat - 394540. E-mail: opad@bankofbaroda.com, Phone: 912621222032

NOTICE TO BORROWER DATE : 09.04.2021 (UNDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT, 2002)				
To, Mr. Ravi Dheerubhai Beladiya (Borrower) Mrs. Vasantben Dheerubhai Beladiya (Co-Borrower) Address:- Plot No. 83, Shri Darshan Residency, Nr. Ishanpora Village, Masma, Taluka, Opad, Dist. Surat Gujarat-394540				
Dear Sir/s Re: Credit facilities with our opad Branch. We refer to our letter no. DB/OLP/HSC/2017 dated 16/10/2017 for your advance account Mr. Ravi Dheerubhai Beladiya (Borrower) , and Mrs. Vasantben Dheerubhai Beladiya (Co-Borrower) conveying sanction of various credit facilities and the terms of sanction. Pursuant to the above sanction you have availed and started utilizing the credit facilities after providing security for the same, as hereinafter stated. The present outstanding in various loan/credit facility accounts and the security interests created for such liability are as under:				
Nature and Type of facility	Limit	Rates of Interest	O/s as on 09.04.2021	Security agreement with brief description of securities
Baroda HOME Loan-term loan	Rs.15,00,000/-	8.25% Net Interest Rate	Rs. 15,44,777.64/- + interest	created and registered through Instrument of deposit of Title Deed Dated 17-10-2017 with Reg No. 16635 With Sub-Registrar, Opad
TOTAL	Rs.15,00,000/-		Rs.15,44,777.64/-	

****Description of Mortgage Property mentioned below:-**
 All that piece and parcel the property bearing Open Plot No. 83(636/83) admeasuring around 60.20 sq.mtrs of "Shree Darshan Residency" the land bearing Revenue Survey No.84, Block No.636 of Village Masma situated at Masma, Taluka, Opad, Dist. Surat, Gujarat. **Boundaries:** East: Plot No.64, West: Society Road, North: Plot No.84, South: Plot No.82

- In the Document of Loan Agreement for Dena Niwas Loan dated 17-10-2017 you have acknowledged to the Bank to the tune of **Rs. 15,00,000/-** as on 17-10-2017. The outstanding stated above include further drawings and interest upto 31-03-2021. Other charges debited to the account are Rs. Nil.
- As you are aware, you have committed defaults in payment of interest on above loans/outstanding for the quarter ended 31-03-2021. You have also defaulted in payment of installments of term loan/demand loans which have fallen due for payment on 31-03-2021 and thereafter.
- Consequent upon the defaults committed by you, your loan account has been classified as non-performing asset on 31-03-2021 (mention date of classification as NPA) in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon.
- Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice under sub-section (2) of section 13 of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating **Rs.15,44,777.64/- (Rupees Fifteen Lakhs Forty Thousand Seven Hundred Seventy Seven and Sixty Four paise only) + interest thereon, plus other charges** as stated in para 1 above, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of payment, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note.
- Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until payment in full.
- We invite your attention to sub-section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act.
- We further invite your attention to sub-section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of the notice for public auction/inviting quotation / tender / private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available.
- Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the right to make further demands in respect of sums owing to us.

Yours faithfully,
Place - Surat | DATE : 09.04.2021 (Chief Manager and Authorised Officer)

NOTICE OF EXTENTION OF EXPRESSION OF INTEREST

With reference to the Notice of Invitation of Expression of Interest date 17 May, 2021 in the matter of **M/s. E COMPLEX PVT LTD.** the last of submission of Expression of Interest was 27 May, 2021.

This is to inform that date of Expression of Interest submission has been extended till **11 June, 2021**.

Further dates and eligibility criteria can be obtained at **Website: http://ipcpjain.com/company/e-complex-private-ltd** or by E-mail at **jain_cp@yahoo.com**

Chandra Prakash Jain
 (Resolution Professional of M/s. E Complex Pvt. Limited)

Place : Ahmedabad Regn. No. IBB/II-001/II-P-00147/2017-18/10311
 Date : 01.06.2021 Mobile: 9824036127, E-Mail: jain_cp@yahoo.com

Canara Bank
Surat Main Branch

DEMAND NOTICE

- To,
1) Janak Mohanbhai Nakum (Borrower)
2) Lalji Mohanbhai Nakum (Co-Borrower)
Above all parties having add at: 540, Varsha Society-2, Nr. Hanuman Mandir, L.H. Road, Surat, Gujarat - 395006 Also at: Plot No. C/6, Raghuvir Row House, Nr. Royal Residency Vibhag-2, Kamrej, Surat - 394185
- 3) Naresh Madhubhai Vanija (Guarantor)** 111, Mukutdhama Society, Nr. Sitaram Nagar, Bombay Market to Punagam Road, Surat, Gujarat - 395010

Dear Sir / Madam,
Sub: DEMAND NOTICE UNDER SECTION 13(2) OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002

You have availed the following loans/credit facilities from our **Surat Main Branch**, from time to time:

Limit	Account No.	Loan Amount (Sanctioned)	Liability as on 03.05.2021	Rate of Interest
Fund Based (Housing Loan)	7170974 0000412	Rs. 25,00,000/-	Rs. 24,81,907.80 (Rs. Twenty Four Lakhs Eighty One Thousand Nine Hundred Seven & Paise Eighty Only) exclusive of other exp. plus further interest thereon.	9.35% (Including 2% penal Interest)

The above said loan/credit facilities are duly secured by way of mortgage of the assets more specifically described in the schedule hereunder, by virtue of the relevant documents executed by you in our favour. Since you had failed to discharge your liabilities as per the terms and conditions stipulated, the Bank has classified the debt as NPA on 02.05.2021. Hence, we hereby issue this notice to you under Section 13(2) of the subject Act calling upon you to discharge the entire liability of **Rs. 24,81,907.80 (Rs. Twenty Four Lakhs Eighty One Thousand Nine Hundred Seven and Paise Eighty Only) as on 03.05.2021** with accrued and up-to-date interest and other expenses, within sixty days from the date of the notice, failing which we shall exercise all or any of the rights under Section 13(4) of the subject Act.

Further, you are hereby restrained from dealing with any of the secured assets mentioned in the schedule in any manner whatsoever, without our prior consent. This is without prejudice to any other rights available to us under the subject Act and/or any other law in force.

Your attention is invited to provisions of sub-section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets. The demand notice had also been issued to you by Registered Post Ack due to your last known address available in the Branch record.

SCHEDULE

The specific details of the assets Mortgaged/Hypothecated are enumerated hereunder:

Mortgaged/Hypothecated assets item wise	Details Description to be given
Janak Mohanbhai Nakum (Borrower) & Lalji Mohanbhai Nakum (Co-Borrower)	Immovable Property of "C" Type, Plot No. 6 at Raghuvir Row House, situated at Kamrej, bearing Survey No. 400, Block No. 391 of Village: Kamrej, Taluka: Kamrej, Dist. Surat. Total adm. about 98.37 Sq. Mtrs. (Plot area as per 7/12 - 72.52 Sq. Mtrs. & As per Site 72.95 Sq. Mtrs. + Undivided Proportionate Share in C.O.P. & Road Land area 25.85 Sq. Mtrs.) Bounded by: North: Block No. 392, South: Society Road, East: Plot No. 5, West: Society Road.

Date: 07.05.2021 | Place: Surat | Authorised Officer, Canara Bank

Canara Bank
Surat Main Branch

DEMAND NOTICE

- To,
1) Jaysukhbhai Babubhai Makani (Borrower)
2) Parvatiben Jaysukhbhai Makani (Co-Borrower)
3) Jaydip Jaysukhbhai Makani (Co-Borrower)
Above all parties having add at: 73, Tapi Darshan Society, Nana Varachha, Surat, Gujarat - 395006. Also at: Plot No. 27-A, Tapi Darshan Society, Nana Varachha, Surat, Gujarat-395006. Also at: Plot No. 258, C Type, Kum Kum Bungalows, Opad Sayan Road, Sandhyer, Surat - 394130
- 4) Umesh Devrajbhai Akolia (Guarantor)** 241, Ruxmani Society, Puna Gam, Choryasi, Surat, Gujarat-395010

Dear Sir / Madam,
Sub: DEMAND NOTICE UNDER SECTION 13(2) OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002

You have availed the following loans/credit facilities from our **Surat Main Branch**, from time to time:

Limit	Account No.	Loan Amount (Sanctioned)	Liability as on 03.05.2021	Rate of Interest
Fund Based (Housing Loan)	7170974 0000676	Rs. 21,60,000/-	Rs. 19,69,248.20 (Rs. Nineteen Lakhs Sixty Nine Thousand Two Hundred Forty Eight and Paise Twenty) exclusive of other exp. plus further interest thereon.	9.65% (Including 2% penal Interest)

The above said loan/credit facilities are duly secured by way of mortgage of the assets more specifically described in the schedule hereunder, by virtue of the relevant documents executed by you in our favour. Since you had failed to discharge your liabilities as per the terms and conditions stipulated, the Bank has classified the debt as NPA on 01.05.2021. Hence, we hereby issue this notice to you under Section 13(2) of the subject Act calling upon you to discharge the entire liability of **Rs. 19,69,248.20 (Rs. Nineteen Lakhs Sixty Nine Thousand Two Hundred Forty Eight and Paise Twenty Only) as on 03.05.2021** with accrued and up-to-date interest and other expenses, within sixty days from the date of the notice, failing which we shall exercise all or any of the rights under Section 13(4) of the subject Act.

Further, you are hereby restrained from dealing with any of the secured assets mentioned in the schedule in any manner whatsoever, without our prior consent. This is without prejudice to any other rights available to us under the subject Act and/or any other law in force.

Your attention is invited to provisions of sub-section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets. The demand notice had also been issued to you by Registered Post Ack due to your last known address available in the Branch record.

SCHEDULE

The specific details of the assets Mortgaged/Hypothecated are enumerated hereunder:

Mortgaged/Hypothecated assets item wise	Details Description to be given
Jaysukhbhai Babubhai Makani (Borrower)	Type "C" Plot No. 258, KumKum Bungalows at Sandhyer, Opad bearing R.S. No. 4/1, 4/2, 4/3 & 9, Block Nos. 45, 46, 47/1 & 47/2 of Village: Sandhyer, Taluka: Opad, Dist. Surat. Total adm. about 124.19 Sq. Mtrs. (Plot area 83.69 Sq. Mtrs. + Undivided proportionate share and C.O.P. & Road area 40.50 Sq. Mtrs.) Bounded by: North: Plot No. 259, South: Plot No. 257, East: Other Plot, West: Society Road.

Date: 07.05.2021 | Place: Surat | Authorised Officer, Canara Bank

DEMAND NOTICE

Under Section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (the said Act), read with Rule 3(1) of the Security Interest (Enforcement) Rules, 2002 (the said Rules), in exercise of powers conferred under Section 13(2) of the said Act read with Rule 3 of the said Rules, the Authorised Officer of IFL Home Finance Ltd. (IFL HFL) (Formerly known as India India Infoline Housing Finance Ltd.) has issued Demand Notice under section 13(2) of the said Act, calling upon the Borrower(s) to discharge the amount mentioned in the respective Demand Notice(s) issued to them. In connection with above, notice is hereby given, once again, to the Borrower(s) to pay within 60 days from the publication of this notice, the amount indicated herein below, together with further interest from the date(s) of Demand Notice till the date of payment. The detail of the Borrower(s), amount due as on date of Demand Notice and security offered towards repayment of loan amount are as under:-

Name of the Borrower(s) / Guarantor (s)	Demand Notice Date & Amount	Description of secured asset (immovable property)
Mr. Bipinbhai Shrivastava, Mrs. Hinabhen Shrivastava (Prospect No. 900941)	27-May-2021 Rs. 8,21,794/- (Rupees Eight Lakh Twenty One Thousand Seven Hundred Ninety Four Only)	All that piece and parcel of the property being: Property No. 530, area measuring 980 sq. ft., Mohanpur, Talod, Pincode: 383310, Gujarat
Mrs. Rekhaben Patel, Mr. Ashvinbhai Patel (Prospect No. 893290 & 819377)	27-May-2021 Prospect No. 893290 Rs. 1,82,246.00/- (Rupees One Lakh Eighty Two Thousand Two Hundred Forty Six Only) and Prospect No. 819377 Rs. 7,79,448.00/- (Rupees Seven Lakh Seven Thousand Nine Hundred Forty Eight Only)	All that piece and parcel of the property being: D 406, area measuring 441 sq. ft., Dev Manek Apartment, Nr. Baiyadev Temple, Canal Road, Vatva, Ahmedabad, Gujarat, 382440

If the said Borrowers fail to make payment to IFL HFL as aforesaid, IFL HFL may proceed against the above secured assets under Section 13(4) of the said Act, and the applicable Rules, entirely at the risks, costs and consequences of the Borrowers. For further details please contact to Authorised Officer of Branch Office: IFL HFL Ahmedabad Commerce House, 4th Floor, Commerce House 4, Nr. Shell Petrol Pump, Anandnagar Road, Prhaladnagar, Ahmedabad - 380051 and India Infoline Finance Ltd. Shop No. 2 & 3, Kumar House, Durga Mill Compound, Near Kumar Electric Showroom, Himmatnagar-383001 or Corporate Office: IFL Tower, Plot No. 98, Udyog Vihar, Ph-V Gurgaon, Haryana.

Place: Ahmedabad and Himmat Nagar Date: 01.06.2021
 Sd/- Authorised Officer, For IFL Home Finance Ltd

Jahangirpura Branch, Shop No. 1 to 6, Raj Green Heights, Opad Road, Jahangirpura, Surat -395 005.
 PH : (0261) 2774866. Email: jahsur@bankofbaroda.com

DEMAND NOTICE TO GUARANTOR

Date: 13.05.2021
 (UNDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT, 2002)

To, **Mr. Hareesh Parsotambhai Kunjajadiya,**
 Plot No. 43/44, Thakordwara Society, Near Haveli, Simadagam, Varachha, Surat-395006.
Sub: Notice under section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, hereinafter called "The Act" in A/c Name: Mr. Hiteshkumar Babubhai Vasoya and Mrs. Darshanaben Babubhai Vasoya. (A.C.No.5802600000428)

Dear Sir/s,
Re: Your Guarantee for Term Loan (Housing Loan) account of Mr. Hiteshkumar Babubhai Vasoya and Mrs. Darshanaben Babubhai Vasoya

- As you are aware, you Hareesh Parsotambhai Kunjajadiya had by a guarantee dated 02/07/2018 guaranteed payment on demand of all moneys and discharge all obligations and liabilities then or at any time thereafter owing or incurred to us by Mr. Hiteshkumar Babubhai Vasoya and Mrs. Darshanaben Babubhai Vasoya under Term Loan (housing loan) with limit of Rs.37,00,000.00 (Rupees Thirty Seven Lacs Only) along with interest thereon more particularly set out in the said guarantee document.
- We invite you to inform you that the borrowers have committed default in payment of their liability and consequently their account has been classified as non-performing asset. A copy of the notice dated 13-05-2021 under section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 sent by us to the borrowers is enclosed. Since the borrowers have committed default in terms of the guarantee you have become liable to pay to us the dues in term Loan (Housing Loan) along with interest which Rs. 36,59,895/- (Thirty Six Lakh Fifty Nine Thousand Eight Hundred Ninety Five Only) as on 13/05/2021 and unapplied interest from 25.04.2021 plus other charges and further interest at the rate mentioned in the notice dated 13/05/2021 served on the borrowers (copy enclosed) and we hereby invoke the guarantee and call upon you to pay the said amount within 60 days from the date of receipt of this notice. Please note that interest will continue to accrue at the rates specified in para 1 of the notice dated 13-05-2021 served on the borrowers (copy enclosed).
- We further wish to inform you that in regard to the security provided by you to secure your guarantee obligations for the due repayment of the loans and advances by the borrower, this notice of 60 days may please be treated as notice under sub-section (2) of section 13 of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. We further give you notice that failing payment of the above amount with interest upto the date of payment, we shall be at liberty to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note.
- We invite your attention to sub-section(13) of section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act.
- We further invite your attention to sub-section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of the notice for public auction/inviting quotation / tender / private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available.
- Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, in the right to make further demands in respect of sums owing to us.

Yours faithfully,
Place: Surat | Date: 13.05.2021 Chief Manager & Authorised Officer Bank Of Baroda, Surat.

APAR APAR INDUSTRIES LIMITED

(CIN : L91110G1989PLC012802)
 Registered Office : 301, Panoramia Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.
 Tel. No. : (0265) 2339906 Fax : (0265) 2330309 E-mail : com.sec@apar.com URL : www.apar.com

EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2021

₹ in crore

Particulars	Consolidated Results			
	Quarter ended		Year ended	
	31.03.2021	31.03.2020	31.03.2021	31.03.2020
	Audited	Audited	Audited	Audited
Total Income from operations (Gross)	1,899.46	1,792.02	6,388.02	7,425.45
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	63.80	32.57	208.27	169.41
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	63.80	32.57	208.27	169.41
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	47.62	23.33	160.50	135.15
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	69.25	(49.96)	242.80	51.71
Equity Share Capital	38.27	38.27	38.27	38.27
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as on 31st March, 2021	--	--	1,370.93	1,128.16
Earnings Per Share (Face Value of ₹ 10/- each) (for continuing and discontinued operations)	12.44	6.10	41.94	35.32

Notes:
 1) The said Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 31st May, 2021.

2) Additional information on Standalone financial results is as follows :

Particulars	₹ in crore			
	Quarter ended		Year ended	
	31.03.2021	31.03.2020	31.03.2021	31.03.2020
	Audited	Audited	Audited	Audited
Total Income from Operations (Gross)	1,791.04	1,691.42	5,960.82	7,017.15
Profit before tax	61.61	35.49	184.70	171.67
Profit for the period	45.14	26.28	136.82	138.98
Total Comprehensive income (after tax)	63.55	(49.49)	216.82	51.40

3) The above is an extract of the detailed format of Statement of Standalone and consolidated financial results filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Statement of Standalone and consolidated financial results are available on the Stock Exchange websites www.bseindia.com (Scrip Code - 532259) and www.nseindia.com (Scrip Symbol - APARINDS) and on Company's website www.apar.com.

For Apar Industries Limited
 Sd/-
Kushal N. Desai
 Chairman & Managing Director
 DIN : 0008084

Place : Mumbai
 Date : 31st May, 2021

AGL ASIAN GRANITO INDIA LIMITED

Regd. Office: 202, Dev Arc, Opp. Iskon Temple, S. G. Highway, Ahmedabad-380015.
 Tel.: +91 79 66125500/698, Fax: +91 79 66125600 CIN: L17110G1995PLC027025
 E-Mail: info@aglasiangranito.com, Website: www.aglasiangranito.com

Extract Of Audited Consolidated Financial Results For The Quarter And Year Ended March 31, 2021

(Rs. In Lakhs Except Per Share Data)

Sr. No.	Particulars	Quarter Ended				
		31.12.2020		Year Ended		
		31.03.2021	31.12.2020	31.03.2020	31.03.2021	31.03.2020
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)
1	Income					
a)	Revenue from operations	43,414.00	38,445.54	25,773.62	129,229.94	122,453.47
b)	Other income	13.37	56.13	246.97	133.85	516.64
2	Net Profit before Tax	2,611.60	3,481.66	713.67	7,519.14	5,465.08
3	Net Profit after Tax	1,903.48	2,504.62	635.20	5,567.07	4,351.35
4	Net Profit attributable to Owners of the Company	1,959.21	2,497.11	704.17	5,700.05	4,218.00
5	Total Comprehensive Income attributable to Owners of the Company	2,001.10	2,490.76	713.00	5,723.10	4,198.80
6	Paid up Equity Share capital (face value Rs. 10 per share)	3405.44	3093.74	3008.74	3405.44	3008.74
7	Other Equity	-	-	-	59,192.36	48,727.07
8	Earnings per Share (not annualised for quarters) (Face value of Rs. 10/- each)					
	- Basic EPS (in Rs.)	6.21	8.08	2.34	18.57	14.02
	- Diluted EPS (in Rs.)	6.21	8.08	2.34	18.57	14.02

NOTES:
 1) The above audited consolidated financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Holding Company at its meeting held on May 31, 2021 and audited by the Statutory Auditors of the Holding Company. The Statutory auditors of the Group have expressed an unmodified opinion on the aforesaid results.

2) These financial results have been prepared in accordance with Indian Accounting Standards ("Ind AS") prescribed under section 133 of the Companies Act, 2013 read with relevant rules issued there-under and in terms of the Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 (the "Listing Regulations"), as modified by Circular dated July 5, 2016.

3) Key numbers of Standalone Financial Results of the Company for the Quarter and Year ended on March 31, 2021.

(Rs. In Lakhs Except Per Share Data)

Particulars	Quarter Ended				
	31.12.2020		Year Ended		
	31.03.2021	31.12.2020	31.0		

